

તા. ૧૫-૦૬-૨૦૧૯

અખબારી યાદી

જાહેર જન આરોગ્ય હિતાર્થે દુધના
લેવાયેલ કુલ ૪ (ચાર) નમુના

મહાલક્ષ્મી ગરમ મસાલા
(૨૦૦ગ્રા.મ.પેક્ડ પાઉચ) તેમજ પનીર (લુઝ)
ખાદ્યચીજનો નમુનો ફેઈલ

ડો. યાજ્ઞિક રોડ પર આવેલ
"શ્રી પંજાબી એન્ડ ચાઇનીઝ" ફાસ્ટફુડ પાર્લરમાં તેમજ
શહેરમાં આવેલ ૩(ત્રણ) સિનેમાગૃહમાં ચકાસણી, ૬૮
કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજનો નાશ તેમજ
આસામીઓને નોટીસ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તથા રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે નીચે દર્શાવેલ કામગીરી જૂન માસમાં કરવામાં આવેલ છે.

(૧) સેમ્પલની વિગત :-

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અન્વયે ઉનાળાની ઋતુને અનુલક્ષીને નીચે દર્શાવેલ સેમ્પલ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે.

ક્રમ.	નમુનાનું નામ	FBO નું નામ અને સરનામું
1.	ભેંસનું દુધ (લુઝ)	નીલકંઠ ડેરી ફાર્મ ન્યુ ૮૦' રોડ, વાવડી
2.	ભેંસનું દુધ (લુઝ)	મધુસુદન ડેરી ફાર્મ ન્યુ ૮૦' રોડ, વાવડી
3.	ભેંસનું દુધ (લુઝ)	રાધીકા ડેરી ફાર્મ ન્યુ ૮૦' રોડ, વાવડી
4.	ભેંસનું દુધ (લુઝ)	આઇ વરૂડી ડેરી ફાર્મ ૪૦' રોડ મેઇન રોડ, મવડી

ઉપરોક્ત સેમ્પલનો રીપોર્ટ આવ્યે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કામગીરી કરવામાં આવશે.

(૨) ફેઈલ ફૂડ સેમ્પલની વિગત :-

આગાઉ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુનામાં નાપાસ થયેલ નમુનાની વિગત નીચે મુજબ છે.

ક્રમ	નમુનાનું નામ	FBO નું નામ અને સરનામું	પરિણામ	નાપાસ થવાનું કારણ
૧	પનીર	નવજીવન ડેરી ફેશ, ન્યુ અંબિકાપાર્ક, સાધુવાસવાણી રોડ	સબસ્ટાન્ડર્ડ	વનસ્પતિની હાજરી
૨	મહાલક્ષ્મી ગરમ મસાલા (૨૦૦ ગ્રા.મ.પેકડ પાઉચ)	અમૃતલાલ એન્ડ સન્ (ઉત્પાદક પેઢી)વાવડી, કિષ્ના પાર્કની નજીક, ગોંડલ રોડ	મિસબ્રાન્ડેડ	FSSAI લોગો દર્શાવેલ નથી.

(૨) ખુલ્લા વેચાતા ખાદ્ય પદાર્થોની ચેકીંગ ઝુંબેશ:-

- ઉનાળાની ઋતુ દરમિયાન તથા ખોરાકજન્ય અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વિવેકાનંદ પુલ પાસે, ડો. યાજ્ઞિક રોડ પર આવેલ "શ્રી પંજાબી એન્ડ ચાઇનીઝ" ફાસ્ટફૂડ પાર્લરમાં સઘન ચકસણી હાથ ધરેલ છે તથા ફૂડ બિઝનેસ ઓપરેટરને સ્થળ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ તેમજ લાયસન્સ સ્થળ પર દર્શાવવા અંગે માર્ગદર્શન આપેલ છે.
- ફૂડ ચેકીંગ કામગીરી દરમિયાન જોવા મળેલ "સેલરમાં પુષ્કળ ગંદકી" બાબતે હાઇજીનીક કન્ડી શન્શક્ષી નોટીસ તેમજ ૬૮ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજનો નાશ કરેલ છે.

(૩) સિનેમાગૃહમાં ચેકીંગ ઝુંબેશ:-

ક્રમ	સિનેમાગૃહ નું નામ	સરનામું	નોટીસ/નાશ ની વિગત
૧	આઇનોક્ષ આર વર્લ્ડ	કસ્તુરબા રોડ	૫૦૦ ગ્રામ વાસી ચટણીનો નાશ તેમજ પ્રિપેર્ડ ફૂડમાં ટેગીંગ લગાવવા અંગેની નોટીસ
૨	ગેલેક્સી સિનેમા	રેસકોર્ષ રીંગ રોડ	યોગ્ય એક્સપાયરી તારીખ અને હાઇજીનીક કન્ડીશનની નોટીસ
૩	રીલાયન્સ આર વર્લ્ડ	૧૫૦' રીંગ રોડ	પ્રિપેર્ડ ફૂડમાં ટેગીંગ લગાવવા અંગેની નોટીસ